

રાજકોટ મહાનગરપાલિકા

ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧

આર.એમ.સી./પી.આર.નં.:-

-: અખબારી યાદી:-

તા.૧૧/૧૦/૨૦૧૯નાં રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ અખબારી યાદીની સ્પષ્ટતા આપવા બાબત.

તારીખ: ૧૧-૧૦-૨૦૧૯

તા.૧૧/૧૦/૨૦૧૯ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવી અખબારી યાદી પ્રસિદ્ધ કરી છે તે અમારા ધ્યાને આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની NULM સેલ અંતર્ગત ચલાવવામાં આવતા તાલીમવર્ગો અંગે એજન્સી દ્વારા ખોટા દસ્તાવેજો ઉભા કરી કૌભાંડ આચરવામાં આવેલ છે તે બાબતે અહેવાલ આપવામાં આવેલ છે. આ સંદર્ભે જણાવવાનું કે આ અહેવાલ અંગે રાજકોટ મહાનગરપાલિકા રદિયો આપે છે, તેમજ આ બાબત સત્યથી તદ્દન વેગળી છે. આ બાબતની સ્પષ્ટ વિગતો આપતા નાયબ મ્યુનિ. કમિશનરશ્રી ચેતન નંદાણીએ વિસ્તૃત વિગત રજૂ કરી હતી જે નીચે મુજબ છે.

સમગ્ર એન.યુ.એલ.એમ યોજનાની અમલવારી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાત રાજ્યના ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશનનાં નિયમો અને માર્ગદર્શનને અધીન કરવામાં આવે છે.

- નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦મા GULM, ગાંધીનગર દ્વારા કુલ ૬૮ એજન્સી ટેન્ડર મારફત તાલીમ વર્ગો ચલાવવા માટે નિમણુંક કરેલ છે. આ એજન્સીઓનું મૂળ MOU, GULM, ગાંધીનગર સાથે રહે છે અને તેઓને વર્ક ઓર્ડર પણ ત્યાંથી આપવામાં આવે છે. આ પ્રક્રિયા દર વર્ષે કરવામાં આવે છે,.
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાલીમ વર્ગોમાં જોડાવા ઈચ્છુક વિદ્યાર્થીઓ જોગ વખતોવખત જાહેરાત પ્રસિદ્ધ કરે છે.જેની નકલ આ સાથે સામેલ છે. જેથી પૂરી પારદર્શિતા જળવાઈ રહે તે માટે પ્રયત્ન કરવામાં આવે છે.

- જે સંસ્થાઓ રાજકોટ શહેર વિસ્તારમાં જ્યારે તાલીમ વર્ગો ચલાવવા માંગતા હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકાને દરખાસ્ત કરે છે. આ તાલીમ વર્ગોની હાજરી પણ આધાર બેઝ બાયોમેટ્રિક્સને ધોરણે કરવામાં આવે છે.
- તાલીમ વર્ગો શરૂ થયાના ૩૦ દિવસ પૂર્ણ થયે ૩૦% લેખેનું પૂર્વ નિયત ગાઈડલાઈન મુજબ તાલીમ વર્ગ ચલાવતી સંસ્થાને ચુકવણું કરવામાં આવે છે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા તમામ વિગતો ચકાસ્યા બાદ જી.યુ.એલ.એમ. - ગાંધીનગર મોકલે છે અને પેમેન્ટ પણ યોગ્ય જણાયે ત્યાંથી કરવામાં આવે છે.
- તાલીમ વર્ગ નો સમયગાળો પૂર્ણ થયે પૂર્વ નિર્ધારિત ગાઈડલાઈન મુજબ સંસ્થાએ તાલીમ પામેલ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું રહે, જે યોજનાની ગાઈડલાઈન મુજબ રાષ્ટ્રીય કક્ષાએ નિમણુંક થયેલ થર્ડ પાર્ટી એજન્સી દ્વારા કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાને આ બાબતે માત્ર રીઝલ્ટ કોપી ફાળવવામાં આવે છે. “ એસેસમેન્ટ એજન્સીની નિમણુંક પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી.”
- તાલીમ વર્ગ પૂર્ણ થયે બાકી રહેતા ૭૦% પેમેન્ટ માટે તાલીમ વર્ગ ચલાવનાર એજન્સીએ ઉત્તીર્ણ થયેલ તમામ તાલીમાર્થીઓને પ્લેસમેન્ટ આપી એક વર્ષ નાં બેંક સ્ટેટમેન્ટ્સ/સેલેરી સ્લીપ જેવા પુરાવા તેઓને ફાળવેલ લોગ ઇન મારફત જી.યુ.એલ.એમના પોર્ટલ પર અપલોડ કરવાનાં રહે છે. આજદિન સુધી તાલીમ વર્ગો મારફત કુલ ૧૯૪૮ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવેલ છે.
- રાજકોટ મહાનગરપાલિકા એન.યુ.એલ.એમ સેલ પ્રોજેક્ટ શાખા અંતર્ગત કુલ ૩૮નાં મહેકમ માંથી, ૪ એન.યુ.એલ.એમ મેનેજર અને ૨૩ જુનિયર સમાજ સંગઠક જી.યુ.એલ.એમ.દ્વારા વર્ષ ૨૦૧૪ તા. ૨૫ નવેમ્બર નાં રોજ થયેલ ઠરાવ અન્વયે શરતો અને નિયમોને આધીન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરાર આધારિત તમામ ભરતી અંગેનાં સરકારી નિયમો ધ્યાને રાખી ભરતી પ્રક્રિયા કરવામાં આવેલ છે.
આ તમામ કર્મચારીઓના કરાર રીન્યુ પણ વખતો વખત જી.યુ.એલ.એમ, ગાંધીનગર દ્વારા પરભારે કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા માત્ર આ કર્મચારીઓ પાસેથી જી.યુ.એલ.એમ.ની સુચના અને ઘટક દીઠ માર્ગદર્શન હેઠળ આ કર્મચારીઓ પાસેથી માત્ર જી.યુ.એલ.એમ નાં ઘટક સંબંધિત કામગીરીનું દેખરેખ અને નિયંત્રણ કરે છે.

- એજન્સી દ્વારા તાલીમવર્ગો પૂર્ણ થયે ઉપસ્થિત કરવામાં આવતા દસ્તાવે જો તેમજ કરવામાં આવેલ પ્લેસમેન્ટ સંબંધિત દાવાઓ અને વિગતો સંપૂર્ણ રીતે ચકાસ્યા બાદ તેઓ ને ચૂકવવા પાત્ર રકમ નક્કી થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાલીમ માટે નિમાયેલી તમામ એજન્સીઓ GULM ગાંધીનગર દ્વારા નિમણુંક કરવામાં આવેલ છે, અને રાજકોટ શહેર કક્ષાએ એજન્સી દ્વારા દરખાસ્ત મળ્યે એજન્સી જે સ્થળે તાલીમવર્ગ ચલાવવા માંગે છે, તેની સંપૂર્ણ સ્થળ તપાસ કર્યા બાદ GULMનાં નિયમોને આધીન અને GULM દ્વારા મંજૂર કરાયા બાદ શરૂ કરવામાં આવે છે.
- અહેવાલમાં જણાવ્યા મુજબ GULM ગાંધીનગર દ્વારા નિયત 30% + 70%નાં ભાગરૂપે એજન્સીને આપવામાં આવતી રકમ સંપૂર્ણ ચકાસણી બાદજ ચૂકવવામાં આવે છે. આ અંગે કોઈપણ ચૂક કે ગેરરીતી જાણમાં આવેલ નથી.

(એ.એમ.)

પ્રોજેક્ટ શાખા, રાજકોટ મહાનગરપાલિકા